

Date: September 07, 2024

То	То		
The Manager,	The Manager,		
Listing Department,	The Department of Corporate		
National Stock Exchange of India Limited,	Service,		
(NSE)	BSE Limited, (BSE)		
Exchange Plaza, C – 1, Block – G, Bandra – Kurla	25 th Floor, Phiroze Jeejeebhoy Tower,		
Complex, Bandra (E), Mumbai – 400 051.	Dalal Street, Fort, Mumbai – 400 001.		
Scrip Code – LINCOLN	Scrip Code - 531633		

Dear Sir / Madam,

<u>Sub:</u> <u>Submission of Newspaper Advertisement with respect to the Notice of 30th Annual General Meeting of the Company, Book Closure, and E-Voting instructions.</u>

Pursuant to Regulation 30 and 47 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, we enclosed herewith the copies of published newspaper advertisement with respect to the Notice of 30th Annual General Meeting of the Company scheduled to be held on Monday, September 30, 2024 at 11:00 a.m. (IST) through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM), Book Closure and E-Voting instructions, published in the following newspapers:

- 1. The Indian Express, Ahmedabad Edition In English;
- 2. Financial Express, Ahmedabad Edition In Gujarati (Vernacular).

We request you to kindly take the above information on your record.

Thanking you,

Yours faithfully,

For Lincoln Pharmaceuticals Limited

Trusha Shah Company Secretary & Compliance Officer

Encl: A/a

Regd. Office: "Lincoln House", Science City Road, Sola, Ahmedabad-380 060. Gujarat, India Phone: +91-79-4107 8000 | Fax: +91-79-4107 8062 | CIN L24230GJ1995PLC024288 E-mail: info@lincolnpharma.com | Website: www.lincolnpharma.com







GOVERNMENT OF KARNATAKA (INFRASTRUCTURE, DEVELOPMENT, PORTS & IWT DEPARTMENT) **KARNATAKA MARITIME BOARD**

Office Of The Port Officer, Port Office Old Mangalore Port, Dakshina Kannada District Old Port, Bunder, Mangaluru 575001. Phone No: 0824-2420374, E-mail: mangaloreport@gmail.com Website: www.karnatakamaritime.in

No:MMD/CR-48/2020-21

Date: 05.09.2024

PUBLIC NOTICE Notice of wreck removal under section 14 of Indian Ports Act-1908 to registered owner of the M.V. ASIAN FOREST

It is informed that, M.V. Asian Forest sailed from New Mangalore Port on 17.07.2009 with cargo of iron ore fines. Vessel developed list and on 18.07.2009 sank 6 nautical miles south of New Mangalore Port. Now, as per Govt. notification No: PWD 142 PSP 2011, Dated: 13.08.2013 wreck of the vessel is in Old Mangalore Port limit.

I, Port Officer, Old Mangalore Port, do hereby issue public notice under Section 397 of Merchant Shipping Act to the bona fide owner of M.V.Asian Forest (Flag: Hong Kong. IMO No: 9369112, Callsign: VRCM9) for removal of the wreck of M.V. Asian Forest which sank on 18.07.2009, 6 nautical miles south off New Mangalore Port. The wreck of the sunken vessel is lying within the port limit of Old Mangalore Port and is posing a hindrance to the safe navigation of the maritime traffic passing along the coast of India and also abstracting fishing activities, thereby causing threat to the marine environment and safety of

The Director General of Shipping issued notice to the registered owners of the sunken vessel directing them to remove the wreck at the earliest. However, even after lapse of 14 years, no action is being taken to remove the wreck

I, Port Officer, Old Mangalore Port, Competent Authority to receive the wreck within the jurisdiction of Old Mangalore Port direct the Owner of sunken vessel M.V. Asian Forest to immediately take action to remove the wreck within 30 days from the publication of this notice. Failure to comply with this notice within the stipulated period action will be taken under section 14 of Indian Port Act-1908 for removal of wreck and dispose off the same through public auction

DIPR / MNG / 579 / MPL / 24-25

31.03.2024-Aroma.pdf.

Port Officer, Mangalore & Competent Authority

VIKRAM AROMA LIMITED

CIN NO: U24296GJ2021PLC121253

Regd. Off: A/704-714, THE CAPITAL, Science City Road,

Ahmedabad - 380060, Gujarat, India

Phone: +91-79-48481010/11/12

E-Mail: vikramaromalimited@gmail.com Web: www.vikramaroma.com

NOTICE OF THE 3rd ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING

INFORMATION, INFORMATION FO VC/OAVM AND BOOK CLOSURE DATES

Notice is hereby given that the 3rd Annual General Meeting (AGM) of the company will be

held on Monday, 30th September, 2024 at 12.00 P.M through Video Conference (VC)/

Other Audio Visual Means (OAVM) in compliance with provisions of Companies Act,

2013 and the rules made thereunder permitted the holding of an Annual General Meeting

("AGM") through VC / OAVM, without the physical presence of the Members at a common

venue. In compliance with the provisions of the Companies Act, 2013 ("Act"), and other

circulars issued by Ministry of Corporate Affairs , Government of India, to transact the

The aforesaid Notice and the Annual Report of the company for the year ended 31st

March, 2024 will be sent in electronic mode to all the members whose e-mail ids are

registered with the Company / Depository Participants. The Notice of the AGM and the

Annual Report will also be available and can be downloaded from the website of the

Company i.e. https://vikramaroma.com/wp-content/uploads/2024/08/Annual-Report

Process for those shareholders whose email ids are not registered with the

depositories for procuring user id and password and registration of e mail ids for

Aadhar Card) by email to (vikramaromalimited@gmail.com).

In case shares are held in physical mode please provide Folio No., Name of

shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self

attested scanned copy of PAN card), AADHAR (self attested scanned copy of

In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID

+ CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated

Account statement, PAN (self attested scanned copy of PAN card), AADHAR (self

attested scanned copy of Aadhar Card) to (vikramaromalimited@gmail.com). If

you are an Individual shareholders holding securities in demat mode, you are

requested to refer to the login method explained at step 1 (A) i.e. Login method

for e-Voting and joining virtual meeting for Individual shareholders holding

Alternatively shareholder/members may send a request to

ivote@bigshareonline.com for procuring user id and password for e-voting by

The Company provides the facility of ECS to all shareholders, holding shares in electro

ic and physical forms. Shareholders holding shares in the physical form who wish to avail

ECS facility, may authorise the Company with their ECS mandate in the prescribed form

which can be obtained from the Registrars and Transfer Agents, Big share Services P. Ltd.

by sending mail to <code>jibu@bigshareonline.com</code>/ vinod.y@bigshareonline.com and the

shareholders holding shares in physical mode are requested to update their complete

Pursuant to section 91 of the companies Act, 2013, the Register of Members and the

Share Transfer books of the company shall remain closed from 24th September, 2024 to

30th September, 2024 (both days inclusive) for the purpose of Annual General Meeting

The company is pleased to provide all its members (holding shares both in physical and

in electronic form) the facility to exercise their vote through remote e-voting to be

provided by National Securities Depository Limited (NSDL). Members of the company

holding shares in physical or dematerialised from as on cut-off date i.e. 23rd September,

2024 may cast their votes through remote e-voting. The remote e-voting shall commence

on Friday, 27th September, 2024 at 9:00 A.M and ends on Sunday, 29th September,

The Board of Directors M/s. A SHAH & ASSOCIATES, Practicing Company

Secretaries (FCS- 4713/ CP NO- 6560) has been appointed as Scrutinizer to scrutinize

The members attending the meeting who have not casted their vote by remote e-voting

will be eligible to cast their vote through e-voting during the AGM. Members who have

casted their votes by remote e-voting prior to the meeting may attend the meeting but shall

not be entitled to cast their vote again. The cut-off date (i.e. record date) for the purpose

Only those members who have registered themselves as a speaker before 7 days of AGM

the remote E-voting process voting at the AGM in fair and transparent manner.

financial year 2023-24 and the AGM to be held on Monday, 30th September, 2024.

businesses that will be set forth in the Notice of the Meeting.

e-voting for the resolutions set out in this notice

securities in demat mode.

bank details with their Depository.

Ahmedabad

Date: 06.09.2024

providing above mentioned documents.

NARMADA WATER RESOURCES WATER SUPPLY & KALPSAR DEPARTMENT

On Line Tender Notice No.06 Of 2024-2025

Water Resource Department intends to select renowned, established suitable Consultant / Agency, for providing Consultancy Services for Development of karnali Ghat on Narmada river Taluka Dabhoi District Vadodara as a Sustainable Tourist/Pilgrimage Destination.RFP Document ncluding the eligibility criteria and other terms & conditions can be downloaded from www.tender.nprocure.com starting from 09/09/2024.The Pre-Bid Conference is scheduled on 23/09/2024.Interested Bidders may contact on se.vic.nwrws@gmail.com & vidvadodara@gmail.com for any further details in this regard.

(B) SCHEDULE OF E-TENDERING

1	Document available online from	Dt.09/09/2024
2	Last date for receiving queries	Dt.21/9/2024
3	Pre-Bid Conference	23/09/2024 at 11:30 Hours at Office of the Superintending Engineer, Vadodara Irrigation Circle, Vadodara
4	Last date for online submission	08/10/2024 at 18:00 Hours
5	Physical Submission of bids	09/10/2024 to 17/10/2024 up to 18:00 Hours
6	On-line verification of Tender Fees and other Documents	18/10/2024 from 11:00 Hours (if possible)
7	Opening of Technical Bids	18/10/2024 from 16:30 Hours (if possible)
8	Office Address & Tel. Number	Office of the Executive Engineer, Vadodara Irrigation Division,7th Floor,Kuber Bhavan,vadodara - 390001

For details regarding submission of tender documents through online-e tender. Please visit the following web site. 1) www.tender.nprocure.com

2) www.statetenders.gujarat.gov.in

INF-VAD-619-2024-25

IMPORTANT

Whilst care is taken prior to

acceptance of advertising

copy, it is not possible to verify its contents. The Indian Express (P) Limited cannot

be held responsible for such contents, nor for any loss or damage incurred as a result of

transactions with companies

associations or individuals

advertising in its newspapers or Publications. We therefore recommend that readers

make necessary inquiries

before sending any monie

agreements with advertiser

or otherwise acting on an advertisement in any

or entering into any

PASCHIM GUJARAT VIJ COMPANY LIMITED

Regd. & Corporate Office, Laxminagar Rajkot CIN U40102GJ2003SGC042908

Invites

Applications for Company / Circle level forum for Represetative of Consumers and Representatives of Prosumers in Company Level / Circle Level CGRF. For further details please visit our web-site www.pgvcl.com

Chief Engineer (Project and R&C)

PRAYAGRAJ MUNICIPAL **CORPORATION**

Civil Lines, Prayagraj, U.P.- 211001

Design, Development, Testing & Commissioning of Inventory Tracking

NOTICE INVITING TENDER (NIT) NIT No:- 3186/PRO/2024, Date: 06 September, 2024

The Chief Engineer (E/M), Prayagraj Municipal Corporation invites online tender for various works as per the details given below:

Name of Work Request for Proposal (RFP) for Selection of Implementation Agency for

and Management System for Prayagraj Municipal Corporation The prospective bidders may download the detailed Tender/Technical Document in this regard from e-tender website- https://etender.up.nic.in from Bidders are requested to submit the Tender Fees and Earnest Money Deposit (EMD) online in account details mentioned under Bid Data Sheet in the Tender Document and submit the proof o

Important Dates:-

Bid upload date/time: Bid Start Date Bid End Date:

payments with Technical Bid to the undersigned

09 September, 2024 09 September, 2024

20 September, 2024

Chief Engineer (E/M) Prayagraj Municipal Corporation

COEP Technological University Pune (Formerly College of Engineering Pune) Shivajinagar, Pune - 411 005. Ph - 020-25507000 / 7009, FAX : (020) 25507299 Website- www.coeptech.ac.in

Admission Notification for University / Institute level Spot Round

It is notified to all aspiring candidates that University / Institute level Spot Round for Admission to various Programmes as per following details for all candidates including CIWGC / OCI / PIO / FN / NRI category candidates for the current Academic Year 2024-25.

Sr. No.	Programmes	SPOT Round Dates
1	First Year B. Planning	9 th and 13 th Sept. 2024
2	First Year B.Tech. (All Branches)	10 th to 13 th Sept. 2024
3	Direct Second Year B.Tech. (Regular)	14 th Sept. 2024
4	Direct Second Year B.Tech. (for Working Professionals)	14 th Sept. 2024
5	First Year M. Tech. (All Specializations) and M. Planning	11 th Sept. 2024
6	First Year MBA	11 th and 12 th Sept. 2024

For further information and detailed schedule of Programme wise SPOT Round, please refer https://www.coeptech.ac.in/ or

COEP Technological University Pune Date: 07/09/2024

adani

Power

Adani Power Limited

NOTICE

NOTICE is hereby given that below mentioned Share Certificate is reported lost / misplaced/stolen:

Name of Shareholder	Certificate No.	No. of Shares		L.F. No.	
Sri Deepak Kumar P	472131	14876	2872721143 - 2872736018	ADP0472071	
Mitaben Bhadreshbhai Doshi	472055	3719	2872041122 - 2872044840	ADP0471995	

Any person who has claim / interest in the said Equity Shares and having any objection to the issue of Duplicate Share Certificate in lieu of the above may write to the Company with supporting documents within 7 days of publication or failing which the Company shall proceed to issue Duplicate Share Certificate in lieu of the same

For Adani Power Limited Sd/-

Place: Ahmedabad Date: 6th September 2024 Deepak S Pandya

Company Secretary

Read, Office: "Adani Corporate House", Shantigram, Near Vaishno Devi Circle, S. G. Highway, Khodiyar, Ahmedabad 382421, Gujarat. | Phone: 079-25557555 | Fax: 079-25557177 | Email: info@adani.com Website: www.adanipower.com | CIN No: L40100GJ1996PLC030533

KEMISTAR CORPORATION LIMITED

604, Manas Complex, Near Jodhpur Cross Road, Satellite, Ahmedabad - 380015, Gujarat. CIN: L24233GJ1994PLC022845 Email: kemistarbse@gmail.com Web: www.kemistar.in

30TH ANNUAL GENERAL MEETING (AGM) TO BE HELD THROUGH VIDEO CONFERENCING (VC)/OTHER AUDIO VISUAL MEANS (OVAM), RECORD DATE AND FINAL DIVIDEND INFORMATION

Notice is hereby given that the 30th Annual General Meeting (AGM) of the Company will be held on Monday, 30th September, 2024 at 12:00 P.M. through Video Conferencing (VC)/ Other Audio-Visual Means (OAVM) facility in compliance with the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, read with General Circulars dated 8th April 2020, 13th April 2020, 5th May 2020, 13th January 2021, 8th December, 2021, 14th December, 2021 and 5th May, 2022 issued by the Ministry of Corporate Affairs ('MCA Circulars') and Circulars dated 12th May 2020, 15th January 2021and 13th May, 2022 issued by the Securities and Exchange Board of India ('SEBI Circulars'), without the physical presence of Members ata common venue. Members will be able to attend the AGM through VC/OAVM facility only. Members participating through the VC/ OAVM facility shall be reckoned for the purpose of quorum under Section 103 of the Companies Act, 2013.

In compliance with the relevant circular, the Notice of AGM and the Annual Report 2023-24 including the financia statements for the financial year 2023-24, along with Directors' Report, Auditors' Report and other documents required to be attached thereto, will be sent only by email to all the Members of the Company whose email addresses are registered with the Company / Depositary Participant(s). The aforesaid documents will also be made available on the website of the Company i.e. www.kp-group.in/kemistar and the websites of the stock exchanges where the shares of the Company are listed i.e. www.bseindia.com as well as on the website of Purva Sharegistry (India) Private Limited i.e. www.evoting@purvashare.com.

Shareholders may note that the Board of Directors in their meeting held on September 06, 2024 recommended a Final Dividend of Rs. 0.50/- per share. The Record date for the purpose of Final Dividend for is September 23, 2024. The Final Dividend, once approved by the shareholders in the ensuing AGM, will be paid electronically through various online transfer modes to those shareholders who have updated their Bank Account details. For shareholders, who have not updated their Bank Account Details, dividend warrants/demand drafts/cheques will be sent to their registered address. To avoid delay in receiving dividend, shareholders are requested to update their KYC with their Depositories (Where shares are held in dematerialized mode) and with the Company's Registrar and Share Transfer Agent (RTA) (Where shares are held in physical mode) to receive dividend directly into their bank account on the payout date. Manner of casting vote(s) through E-voting:

1. Members will have an opportunity to cast their vote(s) on the business as set out in the Notice of the AGM through electronic voting system ('e-voting').

2. The manner of voting remotely ("remote e-voting") by members holding shares in dematerialised mode, physica mode and for members who have not registered their e-mail addresses will be provided in the Notice of the AGM. 3. The facility for e-voting will also be made available at AGM and Members attending the AGM who have not cast their vote(s) by remote e-voting will be able to vote at the AGM.

4. The login credentials for casting votes through e-voting shall be made available to members through email.

$\textbf{5.} \ \ \text{The same login credential may also be used for attending the AGM through VC/OAVM}.$ Manner of registering/updating email addresses:

In case you have not registered your e-mail address with the Company! Depository, please follow below instructions for obtaining the Annual Report and login-in details for joining the AGM/ exercising e-voting facility:

a. Physical holding: please send scan copy of a signed request letter mentioning your Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card), by email to the Company's email address at $kemistarbse@gmail.com\ or\ to\ the\ email\ id\ of\ Purva\ Sharegistry\ (India)\ Pvt.\ Ltd.-Registrar\ \&\ Share\ Transfer$ Agent (RTA) of the Company at support@purvashare.com.

b. Demat holding: Please contact your Depository Participant (DP) and register your email address in your demat

account, as per the process advised by your DP. Members are requested to carefully read all the Notes set out in the Notice of the AGM and in particular, instructions for

joining the AGM, manner of casting vote through remote e-voting or through e-voting during the AGM.

For Kemistar Corporation Limited Ketankumar Patel Managing Director



Madhya Gujarat Vij Company Ltd.

ISO-9001-2008 Certified Company

O&M) Circle Office, 3rd Floor, Nagar Palika Bhavan, NADIAD–387001

Ph. No. (0268) 2562204 / 2562208 Fax No. (0268) 256229

Public Notice

Tender Notice No 10/24 Tenders are invited vide 1). Tender ID No. 90073 for Construction of Protection Wall & Drilling & Developing Of Bore well At Kapadwanj Wess Sub Division under Mahemdabad Division under Nadiad Circle. 2) Tender ID No 1724156162 for Biennial Contract for Office keeping work of Naiad (O&M) Circle Office at 3rd floor Nadiad Nagar Palika Bhayan, Nadiad, for the Year 2024-26 The details are put up on https://tender.nprocure.com & www.mgvcl.com Be in touch with website till

Date:05.09.2024

Indent No. IDD/2023-24/SE0022/call-4)

Superintending Engineer, (O&M), MGVCL, C.O, Nadiad

Government of Karnataka (Infrastructure Development, Ports & Inland Water Transport Department) Karnataka Maritime Board Office of the Marine Engineer, Department of Ports & IWT, Baithkhol, Karwar- 581302

TENDER NOTICE 4th CALL (Only in E-Procurement) (TWO COVER SYSTEM) Tender is invited by the undersigned in E-Procurement (KPPP) porta for the below mentioned service. The reputed, bonafide, resourceful & experienced registered firms/ contractors who have executed and are having experience in similar nature of service can participate in the Tender through E-procurement portal. To obtain more information please visit the website: https://kppp.karnataka.gov.in (Tender

Name of work: (1) Hiring of Pilot Launch with Manning for a period of 3 years at Karwar Port, Uttara Kannada round the clock (24 hrs a day) including Handling, Operation and Maintenance (HOM) charges of Pilot aunch, Fuel, Lubricants, Water, Manning Crew, Maintenance, etc., and inclusive of all applicable taxes. Except GST. Amount Put to Tender (Except GST): Rs. 4,38,00,000.00, EMD: As mentioned in bid document, Last date for Queries: 17.09.2024 @ 17.30 hours, Last Date for receipt of Tender: 20.09.2024@17.30 hours

For further details and general enquiries, interested firms contactors may contact the undersigned office E-mail: marineengineerkwr@gmail.com and phone No.: 08382 221402 during working hours, before last date of queries.

ADK/KSMCA/329/24-25 dt. 06.09.2024

Sd/- Marine Engineer,

Lincoln Pharmaceuticals Ltd.

CIN: L24230GJ1995PLC024288

Regd. Office: "LINCOLN HOUSE", Behind Satyam Complex, Science City Road Sola, Ahmedabad-380060. Gujarat, India. Ph. No. 079 - 4107 8000 E-Mail: investor@lincolnpharma.com • Website: www.lincolnpharma.com

NOTICE OF 30TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 30th Annual General Meeting ("AGM") of Members of the Lincoln Pharmaceuticals Limited ("Company") is scheduled to be held on Monday, September 30, 2024 at 11:00 a.m. (IST) through video conference ("VC") / other audio visual means ("OAVM"), in accordance with the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and in compliance with circulars issued by the Ministry of Corporate Affairs ("MCA"), General Circular No. 09/2023 dated 25th September, 2023, issued by the Ministry of Corporate Affairs ("MCA Circular"), Section VI-J of Master Circular dated July 11, 2023 issued by the Securities and Exchange Board of India ("SEBI Circular"), to transact the business as set out in the Notice convening the AGM.

Dispatch of Annual Report through E-Mail Only:

In compliance with the above mentioned Circulars, AGM Notice and Annual Report for the F.Y. 2023-24 ("Annual Report") of the Company are being sent only through electronic mode to those Members whose e-mail addresses are registered either with the Company or Depositories. Members may note that the AGM Notice and Annual Report are also available on the Company's website at www.lincolnpharma.com and the Stock Exchanges websites at www.bseindia.com and www.nseindia.com.

Book-Closure:

Pursuant to Section 91 of the Act read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 ("Companies Rules"), and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations"), the Register of Members and Share Transfer Book shall remain closed from Saturday, September 14, 2024 to Monday, September 30, 2024 (both days inclusive) for the purpose of determining eligibility of Members to receive dividend for the year ended on March 31, 2024, if approved at the AGM.

General instructions for e-voting:

Pursuant to Section 108 of the Act read with Rule 20 of the Companies Rules, as amended from time to time and Regulation 44 of the SEBI Listing Regulations and Secretarial Standard-2, the Company is pleased to provide to its Members the facility to exercise their right to vote on all the resolutions set out in the AGM Notice by electronic means i.e. through remote e-voting and e-voting during the AGM. The Company have availed the facility for remote e-voting and e-voting during the AGM from CDSL. Members whose name appears as on the cut-off date i.e. Monday, September 23, 2024 shall only be entitled to avail the remote e-voting and e-voting during AGM.

The remote e-voting period will commence on Thursday, September 26, 2024 at 10:00 a.m. (IST) and ends on Sunday September 29, 2024 at 5:00 p.m. (IST). Remote e-voting facility shall not be allowed beyond the said date and time. During this period, the members of the Company may cast their votes electronically on the business as mentioned in the AGM Notice. The remote e-voting module shall be disabled by CDSL for voting thereafter. Other instructions pertaining to remote e-voting and e-voting during the AGM are provided in the notes forming part of the AGM Notice.

Those persons who have acquired shares and have become members of the Company after emailing of notice of AGM by the Company and whose names appear in the Register of Members of the Company / in the statement of beneficial owners maintained by depositories as on cut-off date can exercise their voting rights through Remote e-voting by following the procedure as mentioned in the said Notice of AGM. Members who have already cast their vote by remote evoting prior to the AGM may remain present at AGM through VC/OAVM but shall not be entitled to cast their e-vote again during AGM.

If you have any queries or issues regarding e-voting or participation at AGM, you can write an email to helpdesk.evoting@cdslindia.com or contact at 022-23058738 and 022-23058542/43.

Payment of Dividend and Tax Deducted at Source ("TDS"):

The board of directors of the Company at its Meeting held on May 16, 2024, recommended payment of dividend of ₹ 1.80 (Rupee One and Paise Eighty) per equity share of face value of ₹10/- each (i.e. 18%) for the year ended March 31, 2024, subject to approval of members at the AGM. The members holding shares on record date i.e. the date prior to the commencement of the book closure, will only be entitle to receive the final dividend. The dividend, once approved by the members at the AGM, will be paid within statutory time limit of 30 days, through direct credit to the bank account of who have updated their details with Company / RTA. For those members who have not updated their bank account details, are requested to update their KYC with their depositories/RTA.

Members may note that the Income Tax Act, 1961, ("the IT Act") as amended by the Finance Act, 2020, mandates that dividends paid / distributed by a company after April 01, 2020 shall be taxable in he hands of members. The Company shall therefore be required to deduct tax at source (TDS) at the time of making the payment of final dividend if the amount exceed ₹ 5000/-. To avail benefit of non-deduction of TDS, members are requested to upload duly signed 15G / 15H / 10F on the linkhttps://liiplweb.linkintime.co.in/clientdownloads.html on or before September 12, 2024. Any communication on the tax determination / deduction received post September 12, 2024 shall not be considered.

For Lincoln Pharmaceuticals Limited

Place : Ahmedabad Trusha Shah Pate: September 06, 2024 Company Secretary & Compliance Officer

will be allowed to express their views/ask questions during the AGM. 10. Any person who acquires shares of the company and becomes member of the company

of remote e-voting and Dividend entitlement is 23rd September, 2024.

after the despatch of the Notice and holding shares as of the "cut-off date" i.e. 23rd September, 2024, may obtain the login ID and password by sending a request at ivote@bigshareonline.com. However, if the member is already registered with Bigshare for remote e-voting then the existing user ID and password can be used for remote

11. For the process and manner of remote e-voting, members may go through the remote e voting instructions sent via e-mail to the members whose e-mail IDS are registered with the Company / Depository Participant and physical copy sent to the other members or visit Bighshare's website.

12. In case shareholders/ investor have any queries regarding virtual meeting, you may refer the Frequently Asked Questions ('FAQs') available at https://ivote.bigshareonline.com, under download section or you can email us to ivote@bigshareonline.com or call us at:

For Vikram Aroma Limited

(Ankur Dhirajlal Patel) **Chairman & Managing Director** (DIN - 07395218)

Date: September 06, 2024 Place: Ahmedabad



રીજનલ ઓફિસ, અમદાવાદ : દ્યી સાઉથ ઇન્ડિયન બેંક લિં, રીજનલ ઓફિસ, અમદાવાદ ૪૧૫, ચોથો માળ, સાકાર - VII, નેહરૂ બ્રીજ જંકરાન, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ, ગુજરાત - ૩૮૦૦૦૯, ફોન નં. ૦૯૯-૨૬૫૮૫૬૦૦, ૫૯૦૦, **ਈਮੇ**લ : ro1018@sib.co.in

પઝેશન નોટીસ

આથી, નીચે સહી કરનાર **દ્યી સાઉથ ઇન્ડિચન બેંક લિ ના** અધિકૃત અધિકારીએ સિક્યોરિટાઈઝેશન એન્ડ રીકન્સ્ટક્શન ઓફ ફાયનાન્શીયલ એસેટસ એન્ડ એન્કોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ અધિનિયમ - ૨૦૦૨ તથા સિક્યોરિટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના નિયમ ૩ સાથે વંચાતી કલમ ૧૩(૧૨) હેઠળ મળેલ સત્તાની રૂએ ડીમાન્ડ નોટીસ હેઠળ RO-AHMD-0631-SAR-SH-8725-1910-2023-24 dated 28-Mar-2024 ના રોજ કલમ ૧૩(૨) હેઠળ માંગણી નોટીસ જારી કરીને ઉધારકર્તાઃ (૧). શ્રી ઝ**હુર અદુલ હમીદ કુરેશી (મે**. બીઇંગ ફ્રેન્ડ્સના માલીક), SFX - ૨૪૩, ગુરુનગર, ગાંધીધામ, કચ્છ, ગુજરાત - ૩૭૦૨૦૧ અને અહીં પણ : DBZ S ૩૩, પંજાબ નેશનલ બેંક પાસે, ગાંધીધામ, કચ્છ - ૩૭૦૨૦૧ **અને અહીં પણ** : હાઉસ ૨/૫, સેકટર ૭, ગાંધીધામ, કચ્છ - ૩૭૦૨૦૧ અને <mark>જામીનદારો ઃ (૨). શ્રીમતી પાલેજા આયસાબાઇ મોહ્મ્મદ,</mark> ૨/૫ સેક્ટર ૭, ગાંધીધામ, કચ્છ - ૩૭૦૨૦૧ **અને અહીં પણ** : પ્લોટ નં. ૪, હાઉસ નં. ૭, સેકટર - ૭, ગાંધીધામ, કચ્છ - ૩૭૦૨૦૧, **(૩). શ્રી પાલેજા મોહ્મ્મદ ઉમર**, ૨/૫, સેક્ટર ૭, ગાંધીધામ, કચ્છ - ૩૭૦૨૦૧ **અને** અહીં પણ : પ્લોટ નં. ૪, હાઉસ નં. ૭, સેક્ટર - ૭, ગાંધીધામ, કચ્છ - ૩૭૦૨૦૧ ને નોટીસમાં જણાવેલ રકમ રૂા. ૨૦,૩૦,૩૨૫.૧૫ (રૂા. વીસ લાખ ત્રીસ હજાર ત્રણસો પચ્ચીસ અને પંદર પૈસા પુરા) વત્તા તા. ૨૭.૦૩.૨૦૨૪ ના રોજ થી ચડત વ્યાજ, પીનલ વ્યાજ અને કોસ્ટ વગેરે આ નોટીસ મળ્યાની તારીખ થી ૬૦ દિવસની અંદર પરત ચુકવવા જણાવ્યું હતું.

ઉધારકર્તા/જામીનદારો ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તા/જામીનદારો અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમ ૧૩ની પેટા કલમ (૪) હેઠળ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ ૨૦૦૨ના રૂલ ૮ સાથે મળેલી સત્તાની રૂએ અધિકૃત અધિકારીએ **તા. ou.oe.૨૦૨૪** ન રોજ નીચે જણાવેલ મિલકતોનો **સાંકેતિક કબજો** લઇ લીધેલ છે.

ઉધારકર્તાને વિશેષ ૩૫થી તથા જાહેર જનતાને આથી સદરહ મિલકતો અંગે કોઈપણ જાતનો વ્યવહાર કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ સ્થાયી મિલકતો અંગે કરેલો કોઈપણ વ્યવહાર **દાી સાઉચ** ઈન્ડિયન બેંક લિ ની રકમ રૂા. ૨૧,७૩,૫૮૬.૫૪ (રૂા. એકવીસ લાખ તોતેર હજાર પાંચસો છયાસી અને ચોપન પૈસા પુરા) તા. ૦૪.૦૯.૨૦૨૪ ના સુધીનું, એકાઉન્ટ - મે. બીઇંગ ફ્રેન્ડ્સ, ગાંધીધામ શાખા માટે ચડત વ્યાજ, પીનલ વ્યાજ અને કોસ્ટ સાથેના બોજાને આધીન રહેશે.

સરફેસી કાયદાની કલમ ૧૩ની પેટા કલમ ૮ ની જોગવાઈ પ્રત્યે મુકરર મિલકત છોડાવવા માટે મળવા પાટ સમય બાબતે ધ્યાન દોરવામાં આવે છે.

- શ્રીમતી આયશાબાઈ મોહમ્મદ પાલેજા @ આયસા મોહમ્મદ પાલેજા ની માલીકીનો તમામ ભાગ અને હિસ્સા સાથેની જમીનનું ક્ષેત્રફળ ૭૪.૪૭ સ્કે.મી., રહેણાંક પ્લોટ નં. ૧૦, તમામ બાંધકામો, સુધારાઅં સરળતાના હકો સાથે હાલના અને ભવિષ્ય સાથે, જે સ્થિત સર્વે નં. ૧૩૯, ગામ - કિડાણા, તાલુકો - ગાંધીધામ જીલ્લો - કચ્છ, રાજય - ગુજરાત, વધ સંપૂર્ણ રીતે વર્ણવેલ સેલ ડીડ નં. ૪૩૮૫/૨૦૦૬, તા. ૧૨.૦૭.૨૦૦૬ સબ રજીસ્ટાર ઓફિસ - ગાંધીધામ. **ચતુઃસીમા :- ઉત્તરે** : પ્લોટ નં. ૯, **દક્ષિણે** : પ્લોટ નં. ૧૧, **પૂર્વે** : ૩.૦૫ મી. લેન, **પશ્ચિમે** : ૭.૫૦ મી. રોડ.
- શ્રીમતી આયશાબાઈ મોહમ્મદ પાલેજા @ આયસા મોહમ્મદ પાલેજાની માલીકીનો તમામ ભાગ અને હિસ્સા સાથેની જમીનનું ક્ષેત્રફળ ૭૪.૪૭ સ્કે.મી., રહેણાંક પ્લોટ નં. ૧૧, તમામ બાંધકામો, સુધારાઓ સરળતાના હકો સાથે હાલના અને ભવિષ્ય સાથે, જે સ્થિત સર્વે નં. ૧૩૯, ગામ - કિડાણા, તાલુકો - ગાંધીધામ જીલ્લો - કચ્છ, રાજય - ગુજરાત, વધુ સંપૂર્ણ રીતે વર્ણવેલ સેલ ડીડ નં. ૪૩૮૪/૨૦૦૬, તા. ૧૨.૦૭.૨૦૦૬ સબ ૨જીસ્ટાર ઓફિસ - ગાંધીધામ. **ચતુઃસીમા :- ઉત્તરે** : પ્લોટ નં. ૧૦, **દક્ષિણે** : પ્લોટ નં. ૧૨, **પૂર્વે** : ૩.૦૫ મી. લેન, **પશ્ચિમે** : ૭.૫૦ મી. રોડ.
- શ્રી મોહમ્મદ ઉમર પાલેજાની માલીકીનો તમામ ભાગ અને હિસ્સા સાથેની જમીનનું ક્ષેત્રફળ ૯૧.૫૦ સ્કે.મી.. રહેણાંક પ્લોટ નં. ૧૨. તમામ બાંધકામો, સુધારાઓ, સરળતાના હકો સાથે હાલના અને ભવિષ્ય સાથે જે સ્થિત સર્વે નં. ૧૩૯, ગામ - કિડાણા, તાલુકો - ગાંધીધામ, જીલ્લો - કચ્છ, રાજય - ગુજરાત, વધુ સંપૂર્ણ રીતે વર્ણવેલ સેલ ડીડ નં. ૨૯૮૮/૨૦૦૮, તા. ૨૫.૦૩.૨૦૦૮, સબ ૨જીસ્ટાર ઓફિસ - ગાંધીધામ. **ચતુઃસીમ** :- ઉત્તરે : પ્લોટ નં. ૧૧, દક્ષિણ : જોડેનો સર્વે નં. ૧૪૦, પૂર્વે : ૩.૦૫ મી. લેન, પશ્ચિમે : ૭.૫૦ મી. રોડ.
- શ્રી મોહ્મ્મદ ઉમર પાલેજાની માલીકીનો તમામ ભાગ અને હિસ્સા સાથેની જમીનનું ક્ષેત્રફળ ૪૨.૪૭ સ્કે.મી., ઘર યુનિટ નં. ૫, મેઈન પ્લોટ નં. ૨, શ્રી રાજ નગર કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લિમીટેડ, સેકટર - ૭, તાલુકો - ગાંધીધામ, જીલ્લો - કચ્છ, રાજય - ગુજરાત, વધુ સંપૂ રીતે વર્ણવેલ એલોટમેન્ટ કમ ટાન્સફર ડીડ નં. ૩૪૫/૨૦૧૯, તા. ૨૨.૦૧.૨૦૧૯, સબ રજીસ્ટાર ઓફિસ - ગાંધીધામ. **ચતઃસીમા** :-<mark>ઉત્તરે</mark> ઃ હાઉસ યુનિટ નં. ૪, **દક્ષિણે** ઃ હાઉસ યુનિટ નં. ૬, **પૂર્વે** ઃ પ્લોટ નં. ૧, **પશ્ચિમે** ઃ સોસાયટીની ખુલ્લી જગ્ય અને હાઉસ યુનિટ નં. ૮.

તારીખ : ૦૫.૦૯.૨૦૨૪ સ્થળ : ગાંધીધામ અધિકૃત અધિકારી, ધી સાઉથ ઇન્ડિચન બેંક લિ

માંગલ્ય સોફ્ટ-ટેક લિમિટેડ

CIN - L32100GJ1992PLC017564

Regd. Office- Shop-304, "Sankalp Square-2", Nr. Delux Appartment, Nr. Kalgi Char Rasta, Jalaram Temple, Paldi, Ahmedabad-380006 E-mail: kushal@ratnakarsecurities.com, Contact no. 079-49005200

૩૨મી વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

આથી નોટિસ આપવામાં આવે છે કે માંગલ્ય સોફ્ટ-ટેક લિમિટેડના સભ્યોની ૩૨મી વાર્ષિક નામાન્ય સભા (એજીએમ) સોમવારે, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ બપોરે ૪:૦૦ વાગ્યે કંપની ધારા ૨૦૧૩ ની જોગવાઈના પાલન અર્થે અને ભારત સરકારના કોર્પોરેટ બાબતોના મંત્રાલય (એમસીએ) ના સામાન્ય સર્ક્યુલર નં. ૧૪/૨૦૨૦,૧७/૨૦૨૦, ૨૦/૨૦૨૦, ૦૨/૨૦૨૧, २९/२०२९, ०२/ २०२२, ९०/२०२२ अने ०६/२०२३ मुજબ तेमજ सेजीना सर्झ्युसर नं SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79,SEBI/HO/CFD/ CMD2/CIR/P/2021/11, SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62, SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 અને SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 (હવે પછી સંયુક્ત રીતે સર્ક્યુલર્સ તરીકે ઉલ્લેખ થશે) સાથે વંચાણે લેવામાં અવતા દ્ય સેબી(લીસ્ટીંગ ઓબ્લીગેશન્સ એન્ડ ડીસ્ક્લોઝર રિક્વાયરમેન્ટસ રેગ્યુલેશન્સ,૨૦૧૫(લિસ્ટિંગ રેગ્યુલેશન્સ) નું અનુપાલન કરતાં વિડીયો કોન્ફરન્સ (VC) ની સવિદ્યા મારકતે એજાએમની નોટિસમાં જણાવેલા કામકાજ કરવા માટે યોજવામાં આવશે.

ઉપરોક્ત પરિપત્રો અને લિસ્ટિંગ રેગ્યુલેશન્સ મુજબ, નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટેના વાર્ષિક અહેવાલની સાથે એજીએમની નોટિસ ઇલેક્ટ્રોનિક મોડ મારફતે જે શેર ધારકો ના ઈમેઈલ એડ્રેસ ઓગસ્ટ ૩૦, ૨૦૨૪, શુક્રવાર ના રોજ કંપની/ડિપોઝિટરી પાસે નોંધાયેલ હશે તેઓને જ સપ્ટેમ્બર ૬, ૨૦૨૪ ના રોજ મોક્લી આપવામાં આવેલ છે. ૩૧મી એજીએમની નોટિસ સાથે વર્ષ ૨૦૨૩-૨૪ માટેનો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઈટ www.mangalyasofttech.in, સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ www.bseindia.com તથા એનએસડીએલની વેબસાઇટ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ છે.

દ્ય કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) રુલ્સ્, ૨૦૧૪ સાથે વંચાણે લેવામાં આવતા કંપની ધારા ની કલમ ૯૧ અને લિસ્ટિંગ રેગ્યુલેશન્સ ના રેગ્યુલેશન ૪૨ ના અનુસંધાને કંપની ના સભ્યોનું રજિસ્ટર અને શેર ટ્રાન્સફર બુક એજીએમ ના હેતુસર શનિવાર, સપ્ટેમ્બર ૨૮, ૨૦૨૪ થી સોમવાર, સપ્ટેમ્બર ૩૦, ૨૦૨૪ (બંને દિવસો સમાવિષ્ટ) સુધી બંધ રહેશે અને રિમોટ ઇ-વોટિંગ અથવા સભા દરમિયાન ઇ-વોટિંગ મારસ્ત મત આપવા માટેની પાત્રતા નક્કી કરવા માટે કટ-ઓફ તારીખ સોમવાર, સપ્ટેમ્બર ૨૩, ૨૦૨૪ છે.

કંપની ધારાની કલમ ૧૦૮ અને તે હેઠળ બનાવામાં આવેલા નિયમો અનુસાર, ફક્ત ઈલેક્ટ્રોનિક માધ્યમો હારા મતદાન મારફતે જ સર્વ કામકાજ કરવામાં આવશે. કટ-ઓફ તારીખે શેર ધારણ કરનાર સભ્યો માટે ઈ-વોટિંગ નો પ્રારંભ શુક્રવાર, સપ્ટેમ્બર ૨७, ૨૦૨૪ ના રોજ સવારે ૯-૦૦ ક. (ભારતીય સમય)એ થશે અને રવિવાર, સપ્ટેમ્બર ૨૯, ૨૦૨૪ ના રોજ આંજના ૫-૦૦ ક. (ભારતીય સમય)એ સમાપ્ત થશે. ઉપરોક્ત તારીખ અને સમય પછી રિમોર ઈ-વોટિંગ કરવા દેવામાં આવશે નહીં.એજાએમ દરમિયાન ઈ-વોટિંગ માટેની સચનાઓ એજીએમની નોટીસ મા આપવામાં આવેલી છે.

શ્રી તપન શાહ, જેઓ અમદાવાદ પ્રેક્ટિસંગ કંપની સેકેટરી છે (M. No.-F4476, COP-2839), તેમની વ્યાજબી અને પારદર્શી ઇ-વોટિંગ પ્રક્રિયા થાય તે માટે સ્કુટિનાઇઝર તરીકે નિમણક કરવામાં આવેલ છે.

ઈ-વોટિંગ કે ટેકનિકલ બાબતો સંદર્ભે કંઈ પૂછપરછ હોય તો સભ્યો શેર હોલ્ડરો માટેના ફ્રીક્વન્ટલી આસ્કક્ ક્વેશ્વન્સ (FAQs) ને તપાસી શેકે છે અને શોર હોલ્ડરો માટેનું ઈ-વોટિંગ યુજર મેન્યુઅલ જોઈ શકે છે. જે www.evoting.nsdl.com ના હેલ્પ સેક્શન હેઠળ ઉપલબ્ધ છે: અથવા તો કપયા ટોલ કિ કોલ કરવો. 1800 1020 990 અને 1800 22 44 30 અથવા સુશ્રી પલ્લવી મ્હાત્રે - આસિસ્ટન્ટ વિનંતી અહીં મોક્લવી : એનએસડીએલ, ટ્રેડ વર્લ્ડ, 'એ' વીંગ, ચોથો માળ, કમલા મિલ્સ કમ્પાઉન્ડ, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ-૪૦૦૦૧૩ ખાતે evoting@nsdl.co.in. ઉપર મોક્લવી.

> માંગલ્ય સોક્ટ-ટેક લિમિટેડ વતી. સહી/

અજરાભાદ શાહ તા.: સપ્ટેમ્બર ૦૬, ૨૦૨૪ મેનેજાંગ ડિરેક્ટર સ્થળઃ અમદાવાદ

YAMINI INVESTMENTS COMPANY LTD CIN: L67120MH1983PLC029133

Regd. Off: B-614, Crystal Plaza, opp. Infinity Mall, New Link Road. Andheri(W), Mumbai-400053 Email ID: yaminiinvestments@gmail.com

NOTICE OF 41ST ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

The notice is hereby given that:

1. The 41ST Annual General Meeting ('AGM') of the Company will be held at: B-614 Crystal Plaza, opp. Infinity Mall, New Link Road. Andheri(W), Mumbai-400053 or Saturday, 28th September, 2024 at 01:00 PM through video conferencing (VC)/ othe audio visual means (OAVM) in compliance with all the applicable provisions of the Companies Act, 2013 ("the Act") and the Rules made thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulation" read with General Circular No. 14/2020 dated April 8, 2020 read with General Circular No. 17/2020 dated April 13, 2020 read with General Circular No. 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021 and 20/2021 dated December 8 2021 and 3 /2022 dated May 5, 2022 issued by the Ministry of Corporate Affairs Government of India (collectively referred to as "MCA Circulars") followed by Circula issued by the SEBI (collectively referred to as "relevant circulars") to transact the Ordinary Business, as set out in the Notice of AGM;

Electronic Copies of the Notice of AGM and Annual Report for 2023-24 have bee sent to all members whose email IDs are registered with the Depository Participants. The same is also available on the Company's Website- https://yaminiinvestments.co.in The dispatch of Notice of AGM has been completed on 06th September, 2024.

Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date of 21st September, 2024, may cast their vote electronically on the Ordinary Business as set out in the Notice of AGM through electronics voting system of National

Security Depositary Limited (NSDL) from a place other than venue of AGM ("remote e-voting"). All the members are informed that: The Ordinary Business as set out in the Notice of AGM may be transacted through

- oting by electronics means: nence on Wednesday, 25th September, 2024 a
- 9:00 A.M. IST The remote e-voting shall end on Friday, 27th September, 2024 at 5:00 P.M. IST The cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGM is Saturday, 21st September, 2024.
- Any person, who acquire shares of the Company and become member of Company after dispatch of the Notice of AGM and holding shares as of cut-off date i.e. Saturday, 21st September, 2024, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.com. However, if person is already registered with NSDL for e-voting then existing user ID and password can be used for casting
- Members may note that: a) the remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the members, the member shall not be allowed to change it subsequently b) the facility for voting through ballot paper shall be made available at the AGM; and c) the member may participate in the general meeting even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again in the meeting; and d) a person whose name is recorded in the register of members or in the register of beneficial members maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting or voting
- at the AGM through ballot paper; vii. The Notice of AGM is available on the Company's website www.yaminiinvestments.co.in and
- viii. In case of queries, members may refer to the Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members at the Downloads Section of www.evoting.nsdl.com or call on toll free number 022-48867000/24997000 or at the designated email ID: evoting@nsdl.com., who will address the grievances connected with the electronic voting. Members may also write to the Company Secretary at the above mentioned email ID at yaminiinvestments@gmail.com **BOOK CLOSURE**

The Register of Members and the Share Transfer books of the Company will remair closed from Saturday, 21st September, 2024 to Friday, 27th September, 2024 (both days

For Yamini Investments Company Ltd

🕡 ભારતીય સ્ટેટ બેન્ક

આર.એ.સી.પી.સી.(૬૦૯૨૧) નિલમબાગ ચોક, ભાવનગર. ગુજરાત–૩૬૪ ૦૦૧.

કબજા નોટીસ

આથી નીચે સહી કરનાર અધિકૃત અધિકારી ભારતીય સ્ટેટ બેન્ક, આર.એ.સી.પી.સી, ભાવનગર સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ કાયનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઈન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ તથા સિક્ચોરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ના નિયમ ૩ સહિત વંચાતી કલમ ૧૩ (૧૨) અંતર્ગત મળેલી સત્તાની રૂએ તા.૨૦-૧૦-**૨૦૨૩** ના રોજ માંગણી નોટીસ જારી કરીને દેવાદાર **ગોહિલ શિવરાજસિંહ રાકેશસિંહ** ને નોટીસમાં જણાવેલ રકમ **રૂા.૧૯,૫૮,૪७૩.૦૦ (ઓગણીસ** લાખ અજ્ઞાવન હજાર ચારસો તોતેર રૂપીયા પુરા), તા.૨૦-૧૦-૨૦૨૩ થી આગળનું વ્યાજ તથા આકસ્મીક ખર્ચાઓ સહિતની ઉપરોક્ત નોટીસ મળ્યાનાં ૬૦ દિવસની અંદર પરત ચુકવવા જણાવ્યું હતું.

દેવાદાર ઉપરોક્ત રકમ પરત ચૂકવવામાં નિષ્ફળ ગયા હોવાથી દેવાદાર, કાનુની વારસદાર (જાણીતા-અજાણ્યા), કાનુની પ્રતિનીધીઓ (જાણીતા -અજાણ્યા), જામીનદાર તથા જાહેર જનતાને નોટીસ દ્વારા જણાવવામાં આવે છે કે તા.૩૧/૦७/૨૦૨૪ ના हોનરેબલ ૮મી એડીશન ચીક જયુડીશન મેજીસ્ટ્રેટ સાહેબનો ઓર્ડર નં. CRMA નં.૬૫૪/૨૦૨૪ ઉપરોક્ત નિયમોના નિયમ ૮ સાથે વંચાણે લેતા ઉપરોક્ત એકટની કલમ ૧૩(૪) હેઠળ તેમને/તેણીને મળેલ સતાની 3એ નીચે જણાવેલ મિલ્કતનો પ્રત્યક્ષ કબજો અધિકત અધિકારીએ તા.0૧-૦૯-૨૦૨૪ ના રોજ લીધેલ છે.

ખાસ કરીને ઉધારકર્તા, કાનુની વારસદાર (જાણીતા - અજાણ્યા), કાનુની પ્રતિનીધીઓ (જાણીતા - અજાણ્યા), જામીનદાર અને જાહેર જનતાને આથી સદરહું મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે અને સદરહું મિલકત અંગે કરેલ કોઈપણ વ્યવહાર **ભારતીય** સ્ટેટ બેંક - આર.એ. સી.પી.સી. ભાવનગર ની રકમ રૂા.૧૯,૫૮,૪૭૩.૦૦ (ઓગણીસ લાખ અદ્રાવન હજાર ચારસો તોતેર રૂપીયા પુરા), તા.૨૦-૧૦-૨૦૨૩ થી આગળનું વ્યાજ તથા આકસ્મીક ખર્ચાઓ સહિતની રકમના બોજાને

સરફેસી એકટની કલમ ૧૩-પેટા કલમ(૮) અન્વચે ગીરો મિલ્કત છોડાવવા માટે પ્રાપ્ત સમય મર્ચાદા પરત્વે દેવાદાર/સહદેવાદાર /જામીનદારનું ઘ્યાન દોરવામાં આવે છે.

स्थावर भिલडतोनुं वर्एन

રહેણાકીય મિલ્કતના તમામ ભાગ તથા હિસ્સા કે પ્લોટ નં.૬૧ જેની જમીનનું માપ ૮૧.૯૦ ચો.મી. છે જેના ઉપરનું બાંધકામ ૪७.૮૫ ચો.મી. છે જે રે.સર્વે નં.૧૦૨ પી૧, ખાતે 'ચંદ્રપ્રકાશ રેસીકેન્સી-૨' ગામ : અકવાડા, તા.જી.ભાવનગર.

ઉત્તર : ૬ મીટરનો પહોળો રસ્તો **પશ્ચિમ**ઃ કોમનપ્લોટ દક્ષિણ : સર્વેનં.૧૦૨ પૈકીનીજમીન **પૂર્વ** : પ્લોટનં.ક

તારીખ : ૦૧-૦૯-૨૦૨૪

(નોંધ : વાદ-વિવાદના કિસ્સામાં અંગ્રેજીમાં અધિકૃત અધિકારી, ભારતીય સ્ટેટ બેંક, ભાવનગર પ્રસિધ્ધ થયેલ જાહેરાતનો મુસદ્દો માન્ય ગણાશે.)

શાખા ઓફીસ : યશ બેંક લીમીટેડ, પહેલો માળ, ઓર્બીટ ટાવર, ફૃષી બજાર સામે, સહારા દરવાજા, રીંગ રોડ, સુરત – ૩૯૫૦૦૩. YES BANK રજીસ્ટર્ડ એન્ડ કોર્પોરેટ ઓફીસ : ચશ બેંક લીમીટેડ, ચશ બેંક હાઉંસ, ઓફ વેસ્ટર્ન અક્સપ્રેસ હાઇવે, સાન્વાકુઝ ઈસ્ટ, મુંબઇ – ૪૦૦૦૫ CIN : L65190MH2003PLC143249, Email : communications@yesbank.in, Website : www.yesbank.in

સ્થાવર મિલકતોના વેચાણ માટે વેચાણ નોટીસ सिड्युरीटार्धगेशल એन्ड रीडन्स्ट्रूडशन ओड़ इार्धनान्स्थित ओसेट्स એन्ड એन्ड्रोसीन्ट ओइ सिड्युरीटी ईन्टरेस्ट એन्डर, २००२ हेडળ सिड्योरीटी इन्टरेस्ट (ओन्ड्रोसीन्ट) नियमो २००२ ना ३ल ८(६) न ઈઓ વંચાણે લેતા સ્થાવર મિલકતો માટે ઈ-હરાજી થી વેચાણની નોટીસ

આથી ખાસ કરીને ઉધારકર્તા(ઓ), સહ-ઉધારકર્તાઓ, જામીનદારો અને ગિરવેદારો તેમજ સામાન્ય રીતે જાહેર જનતાને નોટીસ આપી જણાવવાનં કે નીચે જણાવેલ સ્થાવર મિલકત જે મકરર લ્હેણદાર ગિરવે મુકેલ/તારણમાં મુકેલ છે જેની પ્રત્<mark>યક્ષ કળજો</mark> થશ બેંક લી. મુકરર લ્હેણદારના અધિકૃત અધિકારીએ લીધેલ છે, તે "જે**વું છે જયાં છે", "જે છે તેં છે" અને "જે છે ત્યાં છે" ના ધોરણે તાં. ૨૬.૦૯.૨૦૨:** ના રોજ નીચે દર્શાવેલ ઉદ્યારકર્તા, સહ-ઉદ્યારકર્તા, જમીનદારો અને ગિરવેદારો જમીનદાર પાસેથી નીચે દર્શાવેલ બાકી લેણા 🖺 કરાર દરે વ્યાજ અને ચાર્જીસ વસુલ કરવા વેચાણ કરાશે.

 અ. નં.	ઉદ્યારકર્તા / સહ-ઉદ્યારકર્તા /	ડિમાન્ડ નોટિસ રકમ	સ્થાવર મિલકતની વિગતો	અનામત કિંમત અને ઈએમડી (રૂા. માં)
	શ્રી સહદેવ કૈલાશ તુરી (ઉદ્યારકર્તા અને ગિરવેદાર) અને શ્રીમતી જાનકીદેવી (સહ-ઉદ્યારકર્તા અને ગિરવેદાર)		મિલક્ત આવેલ પ્લોટ નં. ૪૦ (કે.જે.પી. પ્રમાણે બ્લોક નં. ૭૨/૪૦) ક્ષેત્રફળ ૪૮.૦૦ સ્કે.ચાર્ડ એટલે કે ૪૦.૧૫ સ્કે.મીટર્સ, સાથે ૨૩.૫૬ સ્કે.મીટર્સ અવિભાજીત ભાગ રોડ અને સીઓપીમાં, આરાધના ગ્લોરીચસમાં, રેવન્થ્યુ સર્વે નં. ૬૩ ખાતે સ્થિત, બ્લોક ૭૨ કુલ ક્ષેત્રફળ હે.આરે. ૪–૮૩–૯૯ સ્કે.મીટર્સ એટલે કે ૪૮૩૯૯ સ્કે.મીટર્સ ગામ મોજે ગામ જોલવા, તા. પલસાણા, ડિસ્ટ્રી. સુરત ખાતે આવેલ સમગ્ર મિલકત.	₹I. €0,000/-
	પ્રકાશ સિંઘ પ્રેમસિંઘ રાવત (ઉદ્યારકર્તા અને ગિરવેદાર) અને ઈન્દ્રાદેવી પ્રકાશ સિંઘ (સહ-ઉદ્યારકર્તા અને ગિરવેદાર)	(રૂા. બાર લાખ બાણું હજાર છસ્સો સિત્થોતેર અને પંદર	પ્લોટ નં. ૧૨૬ ક્ષેત્રફળ ૪૮ સ્કે.ચાર્ડ કેજેપી બ્લોક નં. ૨૧/૧૨૬ બાદ ક્ષેત્રફળ ૪૦.૧૩ સ્કે.મીટર્સ સાથે ૨૫.૦૯ સ્કે.મીટર્સ અવિભાજીત ભાગ સ્વર્ગ રેસીડેન્સીના રોડ અને સીઓપીમાં, બ્લોક નં. ૨૧ ખાતે સ્થિત, ક્ષેત્રફળ હૈ. ૧–૯૮– આરે ૫૯ સ્કે.મીટર્સ એટલે કે ૧૯૮૫૯ સ્કે.મીટર્સ મોજે ગામઃ જોલવા, તા. પલસાણા, ડિસ્ટ્રી. સુરત ખાતે આવેલ સમગ્ર મિલકત.	য়. <i>५</i> ,५०,०००/- য়. <i>५</i> ५,०००/-
	રૂપેશ અશોક ગાંગુર્ડ (ઉદ્યારકર્તા અને ગિરવેદાર) અને ચેતનાબેન રૂપેશ ગાંગુર્ડે (સહ–ઉદ્યારકર્તા અને ગિરવેદાર)		પ્લોટ નં. ૩૯ (૭/૧૨ ૩૫–૩૯ પ્રમાણે) ક્ષેત્રફળ ૮૮.૮૮ સ્કે.ચાર્ડ એટલે કે ક્ષેત્રફળ ૭૪.૪૨ સ્કે.મીટર્સ સાથે અવિભાજીત વણવેચાયેલ ભાગ રોડ અને સીઓપીમાં જેનું ક્ષેત્રફળ દ્ર૨.૬૦ સ્કે.મીટર્સ સોનલ પાર્ક તરીકે જાણીતી સોસાયટી જે આવેલ બ્લોક નં. ૩૫ ક્ષેત્રફળ અંદાજે ૧૦૪૨૧ સ્કે.મીટર્સ ગામઃ આટોદરા, તાલુકાઃ ઓલપાડ, ડિસ્ટ્રીક્ટ: સુરત ખાતે આવેલ સમગ્ર મિલકત.	રૂા. ૯,૫૦,૦૦૦/- રૂા. ૯૫,૦૦૦/-
	જનકભાઈ કાંતિલાલ પટેલ (ઉદ્યારકર્તા અને ગિરવેદાર) અને પટેલ હિનાબેન જનકભાઈ (સહ-ઉદ્યારકર્તા)	(રૂા. બાવીસ લાખ છાંસઠ હજાર એક્સો અડસઠ	મિલકત આવેલ પ્લોટ નં. ૪૦ પ્લાન પ્રમાણે જેનું ક્ષેત્રફળ ૭૪.૪૨ સ્કે.મીટર્સ સાથે અવિભાજીત વણવેચાયેલ ભાગ કહેવાતી જમીનમાં સીઓપી અને રોડ ક્ષેત્રફળ દ્૨.૬૦ સ્કે.મીટર્સ, સોનલ પાર્ક તરીકે જાણીતી સોસાયટીમાં, જે બ્લોક નં. ૩૫ ખાતે સ્થિત, મોજે ગામ આટોદરા, સબ ડિસ્ટ્રીક્ટ તાલુકા – ઓલપાડ, ડિસ્ટ્રીક્ટ સુરત ખાતે આવેલ સમગ્ર મિલકત.	₹I. €,40,000/- ₹I. €4,000/-

રોજ બાકી 💠 ઈ-હરાજીની તારીખ અને સમય : ૨૬.૦૯.૨૦૨૪, સવારે ૧૧:૦૦ થી બપોરે ૨:૦૦ (દરેક પ મિનીટના વધારા સાથે)

💠 બીડ મોકલવાની છેલ્લી તારીખ : ૨૫.૦૯.૨૦૨૪ 💠 મિલકત નિરીક્ષણની તારીખ : ૧७.૦૯.૨૦૨૪

વેચાણ માટેની વિગતવાર નિચમો અને શરતો જોવા મહેરબાની કરીને આપેલ લીંક https://www.yesbank.in/about-us/media/auction-property મુકરર લેણદાર ની વેબસાઈટ www.yesbank.in અથવા https://sarfaesi.auctiontiger.net. જૂઓ. જો ટેન્ડર ડોકચુમેન્ટસ ઈ-બીડીંગ કેટલીંગ મેળવવામાં અથવા સ્થાવર મિલકત મુકરર મિલકતની નિરીક્ષણમાં તકલીફ હોય અને કોઈ કવેરી હોય તો મહેરબાની કરીને **યશ બેંક લી**. ત

અધિકારીનો સંપર્ક કરવો, શ્રી કલ્વેશ રાવલ, મો. ૯৬૨७७ ૨૫૭૫૮ અથવા ઇમેલ : kalpesh.raval@yesbank.in અને મે. ઇ-પ્રોક્ચુરમેન્ટ ટેકનોલોજીસ લીમીટેડ (ઓક્સન ટાઇગર) અમદાવાદ બીડર સપોર્ટ નંબરઃ ૯૨૬૫૫૬૨૮૨૧, ૦૭૯-૬૧૨૦૦૫૯૪/૫૯૮/૫૬૮/૫૬૮/૫૩૮, ઇમેલ : support@auctiontiger.net. નો સંપર્ક કરશો. ઉદ્યારકર્તા / જામીનદારોને વેચાણ નોટીસ

ઉપરોક્ત સુચના U/r તરીકે ગણવામાં આવશે. સિક્ચોરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સ, ૨૦૦૨ ના ૯(૧), પ્રકાશન તારીખથી ૧૫ દિવસની અંદર તે ચૂકવવા માટે બંધાયેલ.

તારીખ : ૦७.૦૯.૨૦૨૪, સ્થળ : સુરત સહી/- કલ્પેશ રાવલ, અધિકૃત અધિકારી

KINETIC ENGINEERING LIMITED

Regd. Office: D-1 Block, Plot No. 18/2, M.I.D.C, Chinchwad, Pune - 411 019 | **Ph.**: 91-20-66142049 | **Fax**: +91-20-66142088/89 Email: kelinvestors@kineticindia.com | Website: www.kineticindia.com

NOTICE OF ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

CIN: L35912MH1970PLC014819

NOTICE is hereby given that an Annual General Meeting (The "AGM" or the Meeting") of the Members of Kinetic Engineering Limited (the "Company") will be held on Monday, 30th September 2024 at 11:30 a.m. IST, through Video Conferencing ('VC')/Other Audio Visual Means ('OAVM') facility to transact the business as set forth in the Notice dated 14th August 2024 convening AGM, ir compliance with Companies Act 2013 read with the Circular No. 09/2023 dated 25th September, 2023 other Circulars issued by the Ministry of Corporate Affairs "MCA Circular") from time to time, Master Circular No. SEBI/HO/CFD/PoD2/CIR P/2023/120 dated 11th July, 2023 and Circular No. SEBI/HO/CFD/CFD-PoD-2/P/ CIR/2023/167 dated 7th October, 2023 issued by SEBI ("SEBI Circular") togethe referred as "Applicable Circulars"

In compliance with the above circulars, electronic copies of the Notice of the AGM along with explanatory statement emailed to all shareholders whose email IDs are registered/available with the Company. The emailing of Notices to shareholders has been completed on 06th September 2024. The same is also available on the Company's website www.kineticindia.com, website of the Stock Exchange i.e BSE Limited at www.bseindia.com and on the website of Central Depositor Services (India) Ltd. ('CDSL') at www.evotingindia.com

The Company has engaged the services of CDSL as the authorized agency fo conducting of the AGM through VC/OAVM facility and for providing electronic voting (e-voting) facility to its members to exercise their votes through remote evoting and e-voting at the AGM. The business set forth in AGM Notice transacted through remote e-voting or e-voting at the AGM. The members are also informed

Date of emailing of AGM Notice along with explanatory statement is 6th September 2024

Cut-off date for determining eligibility of members for the purpose of voting through remote e-voting and participation in AGM and through VC/OAVM facility and e-voting at AGM: 23rd September 2024

Date and Time of remote e-voting: from 27th September, 2024 at 09.00 A.M. IST to 29th September, 2024 at 5.00 P.M IST. Thereafter portal will be disabled Members who have cast their vote may also attend AGM but shall not be entitled to cast their vote again at the AGM.

Only those members who are present at the AGM through VC/QAVM facility and have not cast their vote on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting at

The detailed procedure of generating the Login ID and Password is provided in the Notice of AGM which is available on Company's website www.kineticindia.com and on CDSL website www.evotingindia.com. If the member is already registered with CDSL for e-voting, existing User ID and Password can be used for casting vote.

a) Any person, who acquires shares and becomes member of the Company after dispatch of AGM Notice and holds shares as on cut-off date, may obtain Use ID and Password by sending request to helpdesk.evoting@cdslindia.com or

sandip.pawar@linkintime.co.in or kelinvestors@kineticindia.com Pursuant to MCA Circular No. 14/2020 dated 8th April, 2020, the facility to appoint proxy to attend and cast vote for the members is not available for this

M/s Dinesh Birla & Associates as the Scrutinizer to the e-voting process and voting at the AGM in a fair and transparent manner

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex. Mafatlal Mil Compounds, NM Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call on 1800 22 55 33

For Kinetic Engineering Limited

Date: 06 September, 2024 Place: Pune

Arun Hastimal Firodia DIN: 0005732

Suvidhaa **SUVIDHAA INFOSERVE LIMITED**

CIN: L72900GJ2007PLC109642 Regd. Off.: Unit No 02, 28th Floor, GIFT-II Building, Block No. 56, Road-5C, Zone-5 Gift City, Gandhi nagar, Gujarat- 382355 Corporate office: 14, Olympus Industrial Estate, Off. Mahakali Caves Road, Andheri (E) Mumbai, Maharashtra - 400093 E-mail ID: cs@suvidhaa.com | Web: www.suvidhaa.com

NOTICE OF 17th ANNUAL GENERAL MEETING **AND BOOK CLOSURE**

Notice is hereby given that the Seventeenth (17^{th}) Annual General Meeting ("AGM") of the nembers of Suvidhaa Infoserve Limited ("the Company") is scheduled to be held on Monday, September 30, 2024 at 11:30 A M, through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM) in due compliance with the applicable prov Companies Act, 2013 ("the Act"), the Rules made thereunder read with the MCA's General rculars numbered Circular No. 14/2020 dated 08 April 2020, Circular No.02/2021 dated 13 January 2021, Circular No. 20/2021 dated 12 December 2021, Circular No. 21/2021 dated 14 December 2021, Circular No. 2/2022 dated 5 May 2022 and General Circular No. 10/2022 dated 28 December 2022 respectively and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing Regulations") read with the SEBI Circulars numbered SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, SEBI/HO/CFD/CMD2/ CIB/P/2022/62 dated May 13 2022 and SEBI/HO/CED/PoD-2/P/CIB/2023/4 dated January 5, 2023 and other relevant circulars to transact the businesses as set out in the

In compliance with the applicable provisions of the Companies Act, 2013 (as amended from time to time) and Circulars issued by the Ministry of Corporate Affairs (MCA), electronic copies of the Notice of the AGM and Annual Report 2023-24 have been sent to all the members whose email IDs are registered with the Company/ Depository Participant(s). These documents are also available on the website of the Company a www.suvidhaa.com under investor relations tab, stock exchange websites and on the website of NSDL (agency for providing the Remote e-Voting facility and VC/ OAVM Facility) i.e. www.evoting.nsdl.com. The dispatch of Notice of the AGM and Annual Report through emails has been completed on September 7, 2024.

The Members shall join the meeting 15 (fifteen) minutes before the time scheduled to start the 17th AGM, and the facility allows participation of up to 1,000 Members on a

first come first served' basis. Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide its members the of remote e-voting and e-voting during the AGM through NSDL, the e-voting platform as provided by NSDL which shall enable the Members to cast their votes electronically on the resolutions mentioned in the Notice of AGM. The voting rights of Members shall be in proportion to the shares held by them, as on the cut-off date i.e. Monday, September 23, 2024. The Board has severally appointed Ashish C Doshi, Partner, M/s. SPANJ & Associates, Practicing Company Secretaries, as the Scrutinizer(s for conducting the voting process in a fair and transparent manner.

Any person, who acquires shares of the Company and becomes a member post-dispatch of the Notice of the AGM i.e., September 7, 2024, and holding shares as of on the cut-off date i.e. Monday, September 23, 2024 may obtain the login ID and password by sending a request at evoting@nsdl.com by mentioning your Folio/ DP ID and Client ID No. (16 digit Demat A/c No.) or may visit link: www.evoting.nsdl.com or call on 022 - 4886 7000 for more details. However, if a person is already registered with NSDL for e-voting then the existing user ID and password can be used for casting their

a) The remote e-voting period shall: Commence: On Thursday, September 26, 2024 at 09.00 a.m.

End: On Sunday, September 29, 2024 at 05.00 p.m. The remote e-voting module shall be disabled thereafter b) The remote e-voting shall not be allowed beyond the said date and time;

c) The member who have cast their vote through remote e-voting prior to the meeting may also attend the AGM through VC/ OAVM, but shall not be entitled to cast their vote again during the AGM;

d) Any person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting or e-voting during the AGM;

e) Once a vote is cast by the Member, he/ she shall not be allowed to change i f) The facility for e-voting shall be made available during the AGM through VC/ OAVM

facility for the members who have not cast their vote by remote e-voting; and g) The members who have cast their vote through remote e-voting shall not be entitled to cast their vote again. If a member casts votes by both the modes, then voting done through remote e-voting shall prevail and voting done during the AGM shall be disregarded. In case of any queries pertaining to e-voting, members may refer to the Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members available at the Downloads section of www.evoting.nsdl.com send a request to Ms. Pallavi Mhatre at evoting@nsdl.com or call on 022 - 4886 7000 and ask for e-voting related gueries

Pursuant to Section 91 and other applicable provisions, if any, of the Companies Act. 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements)
Regulations, 2015 the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Tuesday, September 24, 2024 to Monday, September 30, 2024 (both days inclusive) for the purpose of 17th AGM.

Members are requested to carefully read all the Notes set out in the Notice of the AGM and in narticular instructions for ioining the AGM, manner of casting vote through Remote e-voting or through e-voting during the AGM

> For Suvidhaa Infoserve Limited Bhumi Mistry

EITA INDIA LIMITED

CIN: L51109WB1983PLC035969 Regd. Office: 20-B, Abdul Hamid Street, 4th Floor, Kolkata-700 069, Phone: 033-22483203

E-mail: eita.cal@eitain.com, Website: www.eitain.com

NOTICE

Notice is hereby given that 42nd Annual General Meeting (AGM) of the Members of EITA India Limited will be held on Monday, 30th September, 2024 at 2.30 P.M. at the registere office of the Company at 20B, Abdul Hamid Street, 4th Floor, Kolkata - 700 069 to transac the Businesses as set out in the Notice

In compliance with relevant Circulars. Notice of Annual General Meeting along with instructions for remote e-voting and voting at the AGM, Attendance Slip, Proxy Form & Annual Report for the financial year ended 31st March, 2024 has been sent only through electronic mode to those Members whose email addresses are registered with the Company. The said documents are also available on the Company website at ww.eitain.com & CDSL website at www.evotingindia.com.

In this regard, Members whose Email Ids for communication are not registered with the Company /RTA/DP are requested to update the same by following instructions set out

a) Members holding share in demat mode are requested to update their email id, Mobil Nos. Bank Account details and other details with the relevant DPs.

b) Members holding share in physical mode are requested to send a request letter along with the Form ISR 1 mentioning name, folio no., mobile no., email address, number of shares, held & complete postal address along with scanned copy of Share Certificate (both sides), self-attested scanned copy of PAN Card, self-attested scanned copy of Address proof (Aadhaar Card/Passport/Voter ID/Bank Passbook Particulars/Driving license/Electricity Bill/Telephone Bill) in support of the postal addresses of the Members as registered against their shareholdings, to the Company's RTA, Niche Technologies Pvt. Ltd. on their Email at nichetechpl@nichetechpl.com or Company at eita.cal@eitain.com Notice is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 and regulation 42 of SEBI (Listing Obligation & Disclosure Requirements) Regulations, 2015, the share transfer books and Register of Members shall remain closed from 24th September, 2024 to 30th September, 2024 (both days inclusive) for the purpose of 42nd

Annual General Meeting (AGM) of the Company.
The business at the AGM may be transacted through voting by electronic means. The remote e-voting period begins on 27th September, 2024 at 9.00 A.M. (IST) and ends on 29th September, 2024 at $5.00\,P.M.$ (IST). During this period shareholders of the Company holding shares either in physical form or in dematerialization form, as on the cut-off date 23rd September, 2024, may cast their vote electronically. The remote e-voting shall not be allowed beyond said date and time. The members who are holding shares in physical forn or who have not registered their email ID and any person who acquired shares and hecame member after dispatch of Notice of 42nd AGM and holds shares as on the cut-of date, may obtain login ID and password for remote e-voting by sending a request to the Company's RTA at nichetechpl@nichetechpl.com. Members attending the meeting who have not cast their vote by remote e-voting can exercise their right at the venue of the neeting through ballot paper. However, in case vote already casted through remote e voting shall prevail.

For any queries regarding e-voting, members may write to Mr. Rakesh Dalvi, Sr. Manager (CDSL), Central Depository Services (India) Ltd., A Wing. 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N. M. Joshi Marg, Lower Parel (East), Mumbai – 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or contact at toll free no. 1800225533 c contact the Company at eita.cal@eitain.com/blsharma@eitain.com or over phone at 033

Place: Kolkata

By order of the Board For EITA India Limited

લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ

CIN: L28230GJ9664PLC028266

રજી.ઓફીસઃ ''લિંકન હાઉસ'', સત્યમ કોમ્પલેક્ષની પાછળ. સાયન્સ સીટી રોડ. સોલા, અમદાવાદ-૩૮૦ ૦૬૦. **ફોન** : + ૯૧-૭૯-૪૧૦૭-૮૦૦૦

ฮมิฮ์ด : investor@lincoInpharma.com • วัดสเฮอ : www.lincoInpharma.com 30 મી વાર્ષિક સામાન્ય સભા, બુક કલોઝર તથા ઈ-વોટિંગની માહિતી અંગેની નો<u>ટિસ</u>

આથી નોટિસ જારી કરવામાં આવે છે કે કંપની એકટ, ૨૦૧૩ની લાગુ જોગવાઈઓ બનુસાર અને કોર્પોરેટ બાબતોના મંત્રાલય (એમસીએ) દ્વારા જારી કરાયેલ પરિપત્રો, સામાન્ય પરિપત્ર નંબર ૦૯/૨૦૨૩ તારીખ ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ અને સિક્યોરીટીઝ એન્ડ એક્ષચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી પરિપત્ર) દ્વારા જારી કરાયેલ તારીખ ૧૧ જૂલાઈ, ૨૦૨ ૩ના માસ્ટર પરિપત્રની કલમ - VI-J ના અંતર્ગત લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (કંપની)ના સભ્યોની ૩૦ મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) વિડીયો કોન્ફરન્સ/ અન્ય દ્રશ્ય-શ્રાવ્ય (OAVM) ના માધ્યમથી સોમવાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સવારે ૧૧.૦૦ વાગે (IST) યોજાશે.

<u>વાર્ષિક અહેવાલની રવાનગી ફક્ત ઈ-મેઈલ મારફતે :</u>

ઉપરોક્ત પરિપત્રોનું પાલન કરીને જે સભ્યોના ઈ-મેઈલ એડ્રેસ કંપની અથવા ડિપોઝિટરીઝમાં નોંધાયેલા હશે તેવા સભ્યોને એજીએમ નોટિસ અને કંપનીના નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ("વાર્ષિક અહેવાલ") માટેનો વાર્ષિક અહેવાલ ફક્ત ઈલેકટ્રોનિક માધ્યમથી મોકલવામાં આવશે. સભ્યો એ બાબતની નોંધ લઈ શકે છે કે એજીએમ નોટિસ અને વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઈટ પર www.lincoInpharma.com પર અને સ્ટોક એકસચેન્જની વેબસાઈટ પર www.bseindia.com અને www.nseindia.com પર પણ ઉપલબ્ધ છે.

<u>બુક કલોઝર :</u>

કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૧૦ ની સાથે વાંચેલા કાયદાની કલમ ૯૧ મુજબ અને સેબીના રેગ્યુલેશનના નિયમ **૪૨** (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રિક્વાયરમેન્ટસ), ૨૦૧૫, (સેબી લિસ્ટિંગ રેગ્યુલેશન્સ) ના અનુસરણ હેઠળ એજીએમની મંજૂરીને અધિન, ૩૧ માર્ચ, ૨૦૨૪ ના રોજ પૂરાં થયેલાં વર્ષ માટે સભ્યોની ડિવિડન્ડ પાત્રતા નિર્ધારિત કરવા માટે કંપનીની રજિસ્ટર ઓફ મેમ્બર્સ એન્ડ શેર ટ્રાન્સફર બૂકસ શનિવાર, ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી સોમવાર, ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ (બંને દિવસો સમાવિષ્ટ) બંધ રહેશે.

ઈ-વોટિંગ માટે સામાન્ય સૂચનાઓ :

સમયાંતરે સુધારાયેલા કંપનીના નિયમોની કલમ ૧૦૮ અને સાથે કંપનીના નિયમોના નિયમ ૨૦ તથા સેબી લિસ્ટિંગ રેયુલેશન્સ અને સેક્રેટરિયલ સ્ટાન્ડર્ડ-૨ ને અનુરૂપ કંપની તેના સભ્યોને ઈલેકટોનિક સ્વરૂપની એજીએમની નોટિસમાં દર્શાવાયેલા તમામ ઠરાવો પર એજીએમ દરમિયાન રિમોટ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગથી મતદાન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. કંપનીએ એજીએમ દરમિયાન રિમોટ ઈ-વોટિંગ તથા ઈ-વોટિંગની સુવિધાનો લાભ CDSL પાસેથી લીધો છે. જે સભ્યોના નામ નિર્દિષ્ટ તારીખ એટલે કે સોમવાર, ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં રજિસ્ટર ઓફ મેમ્બર્સ/લાભાર્થી માલિકમાં ચઢી ગયા હોય તેઓ જ એજીએમ દરમિયાન રિમોટ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગ કરવા અધિકારપાત્ર રહેશે.

રિમોટ ઈ-વોટિંગ ગુરૂવાર ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૦૦ વાગે (આઈએસટી) એ શરૂ થઈ રવિવાર, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ ના રોજ સાંજે પ.૦૦ વાગે (આઈએસટી)એ બંધ થશે. નિર્દિષ્ટ તારીખ અને સમય બાદ રિમોટ ઈ-વોટિંગ સુવિધાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સમયગાળા દરમિયાન કંપનીના સભ્યો એજીએમની નોટિસમાં દર્શાવેલ કારોબારી બાબતો અંગે ઈલેકટ્રોનિકલી પોતાના મત આપી શકશે. ત્યારબાદ સીડીએસએલ દ્વારા રિમોટ ઈ-વોટિંગ મોડ્યુલ બંધ કરી દેવાશે. એજીએમ દરમિયાન રિમોટ ઈ-વોટિંગ અને ઈ-વોટિંગને લગતી અન્ય સૂચનાઓ એજીએમ

નોટિસના અંતર્ગતની નોંધોમાં આપવામાં આવી છે. જે વ્યકિતઓએ શેર હસ્તગત કર્યાં હોય અને કંપની દ્વારા એજીએમની નોટિસ ઈમેલ કર્યા પછી કંપનીના સભ્ય બન્યાં હોય હોય તથા જેમના નામ કટ-ઓફ તારીખ સધીમાં કંપનીના રજિસ્ટર ઓફ મેમ્બર્સ/ ડિપોઝટરીઝ દ્વારા જાળવવામાં આવતાં લાભાર્થી માલિકના સ્ટેટમેન્ટમાં ચઢી ગયા હોય તેવા સભ્યો એજીએમની ઉપરોક્ત નોટિસમાં ઉલ્લેખિત પ્રક્રિયાને અનસરીને રિમોટ ઈ-વોટિંગ દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે. જે સભ્યોએ એજીએમ અગાઉ રિમોટ ઈ-વોટિંગ દ્વારા મતદાન કર્યું હોય તેઓ વીસી/ઓએવીએમ મારફતે એજીએમમાં હાજર રહી શકે છે, પરંતુ એજીએમ દરમિયાન ફરીથી ઈ-વોટિંગ કરવાનો હકદાર રહેશે નહીં.

જો તમને એજીએમમાં ઈ-વોટિંગ અથવા સહભાગિતા સંબંધિત કોઈપણ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય, તો તમે helpdesk.evoting@cdslindia.com ઈમેઈલ કરી શકો છો અથવા ૦૨૨-૨૩૦૫૮૭૩૮ અને ૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩૫૨ સંપર્ક કરી શકો છો. ડિવિડન્ડની ચુકવણી અને ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (''ટીડીએસ''):

૧૬ મે, ૨૦૨૪ ના રોજ યોજાયેલી કંપનીની બોર્ડ ઓફ ડિરેકટર્સની બેઠકમાં ૩૧ માર્ચ, ૨૦૨૪ ના રોજ પૂર્ણ થયેલા વર્ષ માટે એજીએમમાં સભ્યોની મંજૂરીને અધિન રૂ. ૧૦ ની મૂળ કિંમતના પ્રત્યેક ઈક્વિટી શેર દીઠ રૂ. ૧.૮૦ (એક રૂપિયો અને એંશી પૈસા)(એટલે કે ૧૮%) નું ડિવિડન્ડ ચૂકવવાની ભલામણ કરાઈ હતી. રેકોર્ડ ડેટના રોજ એટલે કે બુક કલોઝર શરૂ થયા અગાઉ જે સભ્યો પાસે શેરની માલિકી હશે માત્ર તેઓ જ અંતિમ ડિવિડન્ડ મેળવવાને હકદાર રહેશે. એજીએમમાં સભ્યો દ્વારા મંજૂરી મળ્યાં બાદ જે સભ્યોએ પોતાની બેન્કની વિગતો કંપની/ આરટીએમાં અપડેટ કરાવી છે તેમને ડિવિડિન્ડ ૩૦ દિવસની વૈધાનિક સમયમર્યાદામાં સીધા તેમના ખાતામાં જમાં આપવામાં આવશે. જે સભ્યોએ તેમની બેન્કની વિગતો સુધરાવી નથી તેમને ડિપોઝિટરીઝ/ આરટીએમાં તેમની કેવાયસીની વિગતો સુધારી લેવા અપીલ છે.

સભ્યોએ એ વાતની નોંધ લેવી કે ફાયનાન્સ એક્ટ,૨૦૨૦ દ્વારા સુધારાયેલા ઈન્કમટેકસ એક્ટ, ૧૯૬૧ (આઈટી એક્ટ) અંતર્ગત ૧ એપ્રિલ, ૨૦૨૦ બાદ કંપની દ્વારા ચૂકવાયેલ/ વિતરીત કરાયેલ ડિવિડન્ડ સભ્યો માટે કરપાત્ર છે. આથી કંપનીએ અંતિમ ડિવિડન્ડની ચૂકવણી વખતે જો સ્ક્રમ રૂા. ૫૦૦૦/- થી વધુ હોય તો ટીડીએસ કપાત કરવી જરૂરી છે. ટીડીએસની કપાત ટાળવા માટે સભ્યોને સહી કરેલું 15G/ 15H/ 10F ફોર્મ ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ કે તે પહેલા આ લિન્ક https://liiplweb.linkintime.co.in/client-downloads.html પર ભરી દેવા વિનંતી છે. ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ પછી કરાયેલો ટેક્સ નિર્ધારણ/ કપાત માટેનો કોઈ પણ પત્ર વ્યવહાર ધ્યાનમાં લેવામાં નહીં આવે.

લિંકન ફાર્માસ્થુટીકલ્સ લિમિટેડ, વતી

સહી/-વેત્રા શાધ

ક્થળ : અમદાવાદ તારીખ : સપ્ટેમ્બર,૦૬, ૨૦૨૪ કંપની સેક્ટરી અને કમ્પલાઈન્સ ઓક્સિર

Date: September 07, 2024 Place: Mumbai

Company Secretary and Compliance Officer